


F. Y. B.Sc. માં પ્રવેશાર્થીઓ માટેની માહિતી

Online Admission Process Chart



અગત્યનું સમય પત્રક (Important Dates)

	Starting Date and time	Ending date and time
Online form filling and modification	17-05-2019 (10:30 am)	30-05-2019 (06:10 pm)
First merit list publish and online fee payment for selected students.	10-06-2019 (10:30 am)	12-06-2019 (06:10 pm)
Document verification for the selected students in 1 st merit list.	12-06-2019 11:00 am to 03:00 pm	13-06-2019
Second merit list publish and online fee payment for selected students.	17-06-2019 (10:30 am)	19-06-2019 (06:10 pm)
Document verification for the selected students in 2 nd merit list.	19-06-2019 11:00 am to 03:00 pm	20-06-2019
Third merit list publish and online fee payment for selected students.	23-06-2019 (10:30 am)	25-06-2019 (06:10 pm)
Document verification for the selected students in 3 rd merit list.	25-06-2019 11:00 am to 03:00 pm	26-06-2019
Fourth merit list publish and online fee payment for selected students.	29-06-2019 (10:30 am)	01-07-2019 (06:10 pm)
Document verification for the selected students in 4 th merit list.	01-07-2019 11:00 am to 03:00 pm	02-07-2019
Fifth merit list publish and online fee payment for selected students.	04-07-2019 (10:30 am)	06-07-2019 (06:10 pm)
Document verification for the selected students in 5 th merit list.	06-07-2019 11:00 am to 03:00 pm	07-07-2019

- Number of merit list will be subject to the availability of vacancies.

ખાસ નોંધ:

- ઓનલાઈન ફોર્મ 30-05-2019 પછી કોઈપણ સંજોગોમાં ભરી શકાશે નહિ.
- અનિવાર્ય સંજોગોમાં જ તારીખમાં ફેરફાર કરવામાં આવશે. આથી કોલેજની વેબસાઈટ હંમેશા જોવાનું રાખશો.

ઓનલાઇન એડમિશન પ્રક્રિયા

૧. પ્રથમ તબક્કો: (ફોર્મ ભરવું)

- એડમિશન ફોર્મ ભરતા પહેલા માહિતી પુસ્તિકા અવશ્ય વાંચવી
- ફોર્મ ભરતી વખતે સાચી માહિતી ભરાય તેની કાળજી રાખવી

ફોર્મ માં upload કરવાનો થતો પ્રવેશાર્થીનો ફોટો માર્કશીટ માં આવવાનો હોય, white background વાળો યોગ્ય સાઈઝ (Max 50 kb) નો ફોટો હોવો ફરજિયાત છે.

૨. બીજો તબક્કો: (ફોર્મ ફી Rs. 20 ભરવી)

- પ્રવેશાર્થીએ પોતાનાં અથવા વાલીના કાયમી મોબાઈલ નંબર તથા પ્રવેશાર્થીએ પોતાનાં જ E-mail id થી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. (ફોર્મ તથા ફી રીસીપ્ટ પ્રવેશાર્થીને E-mail માં મોકલવામાં આવશે જેથી E-mail id પ્રવેશાર્થીનું પોતાનું જ હોવું ફરજિયાત છે)
- ઉપરોક્ત માહિતી submit કર્યા બાદ મોબાઈલ તેમજ email માં આવેલ OTP enter કરી રજીસ્ટ્રેશન ફી ₹૨૦ ઓનલાઈન ભરવાની રહેશે.

૩. ત્રીજો તબક્કો: (એડમિશન ફી ભરવી)

- જે પ્રવેશાર્થીનું મેરિટ લિસ્ટમાં નામ આવે તેમણે નિયત સમય મર્યાદામાં ઓનલાઈન એડમિશન ફી ભરવાની રહેશે .

૪. ચોથો તબક્કો: (ડોક્યુમેન્ટ વેરીફિકેશન)

- એડમિશન ફી ભરાઈ ગયા બાદ વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મમાં દર્શાવેલ નિયમો મુજબ જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્વપ્રમાણિત કરીને ક્રમ પ્રમાણે ગોઠવીને (બે નકલમાં) કોલેજમાં ચકાસણીના હેતુથી જમા કરાવવાના રહેશે અને તેની સાથે ધોરણ-૧૨ ની અસલ માર્કશીટ એનરોલમેન્ટ માટે જમા કરાવવાના રહેશે.

પ્રવેશના નિયમો

1. અનામત જૂથોની પ્રવેશ અંગે ની ટકાવારીનું ધોરણ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ આ પ્રમાણે છે.

અનામત જૂથ	અનામત પ્રવેશ અંગેની ટકાવારી
SC	7%
ST	15%
SEBC	27%
Economically Weaker Section(EWS)(EBC)	10%

2. અનામતના તમામ નિયમો મેરીટ યાદીના પ્રસિધ્ધ થવાના દિવસે અમલમાં હશે તે જ લાગુ પડશે.
3. મેરિટની ગણતરી માટે ધોરણ-૧૨ ના મુખ્ય વિષયો: ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર/જીવવિજ્ઞાનના થિયરીના માર્ક્સ જ ધ્યાને લેવામાં આવશે.
4. વર્ષ-2019 પહેલા પાસ થયેલા વિદ્યાર્થીના વર્ષ દીઠ 5 (પાંચ) માર્ક્સ ઓછા કરીને મેરિટ ગણવામાં આવશે.
5. ગુજરાત બોર્ડ સિવયના પ્રવેશાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રોવિઝનલ એલિજિબિલીટી સર્ટીફિકેટ રજૂ કરવાનું રહેશે.

પ્રવેશાર્થીઓ માટેની સુચના:

1. અરજદારે અરજીપત્રક ઓનલાઈન ભરવાનું રહેશે.
2. વર્ષ 2019-20 માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ અંગેની સૂચનાઓ ધ્યાનથી વાંચો. પ્રવેશ પ્રક્રિયા પ્રવેશ યાદીમાં દર્શાવેલ તારીખો મુજબ જ કરવામાં આવશે.
3. પ્રવેશ માટેની મેરિટ સૂચિ તૈયાર કરવા માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અથવા જીવવિજ્ઞાન વિષયના થિયરીમાં આવેલ ગુણ જ ગણવામાં આવશે. અન્ય વિષયો અને પ્રેક્ટિકલના ગુણ મેરિટ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
4. A-ગ્રુપ અને B-ગ્રુપના અરજદારોની મેરિટ યાદી અલગથી પ્રદર્શિત કરવામાં આવશે.
5. પસંદ પામેલ અરજદારોની મેરિટ યાદી કૉલેજ વેબસાઈટ પર મૂકવામાં આવશે. પ્રવેશ, મેરિટ આધારિત જ મળશે.
6. મેરિટ યાદીની વિગત અને સત્ર ફીની ચુકવણી કૉલેજ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. કોઈપણ અપડેટ માટે નિયમિતપણે કૉલેજ વેબસાઈટની મુલાકાત લેતા રહેવું.
7. મેરીટ યાદી પ્રમાણે પસંદગી પામતા વિદ્યાર્થીએ અરજીપત્રક ની પ્રિન્ટ અને સૂચનાઓના પેજની પ્રિન્ટ લેવાની રહેશે. વિદ્યાર્થી અને વાલીએ અરજીપત્રક અને સૂચનાઓના પેજ પર સહી કરવાની રહેશે. એડમિશન શેડ્યુલ 2019-20 માં જણાવ્યા મુજબની તારીખ અને સમયે વિદ્યાર્થીએ સહી કરેલ અરજીપત્રક અને સૂચનાઓના પેજ, જરૂરી પ્રમાણપત્રો સાથે ચકાસણી માટે પ્રવેશ સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે.
8. અરજીપત્રક સાથે નીચે જણાવેલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ જોડવાની રહેશે.
 - a) 10th માર્કશીટ ની નકલ(બધી).
 - b) 12th માર્કશીટ ની નકલ(બધી).
 - c) શાળા છોડ્યા અંગે નુ પ્રમાણપત્ર (LC) ની નકલ.
 - d) શાળા દ્વારા આપવામાં આવેલ ટ્રાયલ સર્ટીફિકેટ ની નકલ.
 - e) આધારકાર્ડ ની નકલ,
 - f) અનામત કેટેગરી અથવા અન્ય કોઈપણ કેટેગરીનો લાભ લીધેલા ઉમેદવારોએ જે તે કેટેગરીના પ્રમાણપત્રો ની નકલ સાથે લાવવાની રહેશે અન્યથા તેમને અનામત/કેટેગરીનો લાભ મળી શકશે નહીં.
 - g) SEBC કેટેગરીના ઉમેદવારોએ 2019-20 માટે માન્ય હોય તેવું ગુજરાત સરકારના સત્તાધારી સત્તા દ્વારા આપવામાં આવેલ નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ(NCL) રજૂ કરવાનું રહેશે.
 - h) શારીરિક અસક્ત વ્યક્તિ માટે સિવિલ સર્જન અથવા સમકક્ષ અધિકારીએ ફાળવેલ શારીરિક અશક્તતાનું પ્રમાણપત્ર.
 - i) ભૂતપૂર્વ સર્વિસમેનનું પ્રમાણપત્ર, ડિરેક્ટર, સૈનિક કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા અથવા જિલ્લાના સૈન્ય કલ્યાણ અધિકારી દ્વારા જારી કરાયેલ, જો લાગુ પડતું હોયતો.

D K V Arts and Science College, Jamnagar.

- j) Gujarat Higher Secondary Education Board સિવાયના અન્ય બોર્ડના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી Provisional Eligibility Certificate(PEC) કઢાવવાનું રહેશે. અરજીપત્રક ભરતી વખતે PEC નંબર નાખવો ફરજિયાત છે.
- k) પ્રમાણપત્રોની ચકાસણી સમયે ધોરણ 12ની ઓરિજનલ માર્કશીટ અને શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC) કોલેજમાં જમા કરાવવાના રહેશે.

Note: ઉમેદવાર ફક્ત તે જ સ્વ-પ્રમાણિત નકલો જોડશે જે અરજી ફોર્મ સાથે જોડાવા માટે જરૂરી છે.

9. પ્રવેશ સમિતિ સમક્ષ જરૂરી ઓરીજનલ પ્રમાણપત્રો જમા કરાવ્યા બાદ જ અરજીપત્રક સ્વીકાર્ય થશે.
10. જો કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપવામાં આવેલ હશે તો ડોક્યુમેન્ટ ચકાસણી સમયે અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં, અને તે અરજી રદ ગણવામાં આવશે.
11. અરજીપત્રક તથા એડમિશન ફી ઓનલાઈન ભરવામાં આવશે. કોઈપણ પ્રકારની ફી ભરવા કોલેજે આવવાનું રહેશે નહીં.
અરજીપત્રક તથા એડમિશન ફી એક વખત ભરાઈ ગયા બાદ પરત આપવામાં આવશે નહીં.
12. એડમિશન શેડ્યુલમાં જણાવ્યા મુજબ, જો નિયત સમયમાં વિદ્યાર્થી ફી ભરવામાં અને/અથવા ડોક્યુમેન્ટ ચકાસણીમાં નિષ્ફળ જશે તો તેનો પ્રવેશ પરનો હક રદ ગણવામાં આવશે અને તેની પછીના ઉમેદવારને પ્રવેશનો લાભ આપવામાં આવશે. આ બાબતે કોઈ લાગવગ કે અન્ય કારણ માન્ય રાખવામાં આવશે નહીં.
13. કોલેજ દ્વારા ચાર પ્રકારના સબજેક્ટ કોમ્બીનેશન આપવામાં આવે છે, જેનું વર્ગીકરણ ગ્રુપ A અને ગ્રુપ B માં નીચે મુજબ છે.

For A group	For B group
Physics, Chemistry, Mathematics (PCM)	Chemistry, Botany, Zoology (CBZ)
	Physics, Chemistry, Zoology (PCZ)
	Physics, Chemistry, Botany (PCB)

વિદ્યાર્થી કોઈ પણ એક ગ્રુપ પસંદ કરવાનું રહેશે. એક ગ્રુપ પસંદ થઈ ગયા પછી બદલી આપવામાં આવશે નહીં.

14. વિદ્યાર્થીએ બધા જ વર્ગો, પ્રેક્ટિકલ નિયમિત ભરવાના રહેશે. બધા જ government initiatives માં સક્રિય ભાગ લેવાનો રહેશે. કોલેજના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો વિદ્યાર્થી ઉપરના નિયમોના પાલનમાં નિષ્ફળ જશે, તો તેનો પ્રવેશ રદ કરવામાં આવશે તથા શિસ્ત સંબંધીત કાર્યવાહી કરવામાં આવશે.
15. કોલેજના ક્લાકો દરમિયાનની કોઈ પણ પ્રકારની નોકરી કરવાની રહેશે નહીં.
16. દરેક વિદ્યાર્થી પાસે શિસ્ત અને સુવ્યવહારનો આગ્રહ રાખવામાં આવે છે.

વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન તથા ફોર્મ જમા કરાવતી વખતે કોલેજ લઈ જવાના પત્રકોની યાદી:

1. ડાઉનલોડ કરેલ એડમીશન ફોર્મ (નીચે દર્શાવેલા પત્રકો ની સ્વપ્રમાણિત નકલ જોડી ને)
 - (i) 12th માર્કશીટ ની નકલ
 - (ii) 10th માર્કશીટ ની નકલ
 - (iii) શાળા છોડ્યા અંગે નુ પ્રમાણપત્ર/ LC ની નકલ
 - (iv) શાળામાંથી આપવમાં આવેલ ટ્રાયલ સર્ટીફિકેટ ની નકલ
 - (v) આધારકાર્ડ ની નકલ
 - (vi) અનામત કેટેગરી અથવા અન્ય કોઈપણ કેટેગરીનો લાભ લીધેલા ઉમેદવારોએ જે તે કેટેગરીના પ્રમાણપત્રો ની નકલ સાથે લાવવાની રહેશે અન્યથા તેમને અનામત/કેટેગરીનો લાભ મળી શકશે નહીં.
 - (vii) SEBC કેટેગરીના ઉમેદવારોએ 2019-20 માટે માન્ય હોય તેવું નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ રજૂ કરવાનું રહેશે. અન્યથા તેમને SEBC કેટેગરીનો લાભ મળી શકશે નહીં અને લીધેલો પ્રવેશ રદ થશે.
2. ડાઉનલોડ કરેલ એનરોલમેન્ટ ફોર્મ (નીચે દર્શાવેલા પત્રકો ની સ્વપ્રમાણિત નકલ જોડી ને)
 - (i) 12th માર્કશીટ ની નકલ.
 - (ii) 10th માર્કશીટ ની નકલ
 - (iii) શાળા છોડ્યા અંગે નુ પ્રમાણપત્ર/ LC ની નકલ
 - (iv) શાળામાંથી આપવમાં આવેલ ટ્રાયલ સર્ટીફિકેટ ની નકલ
 - (v) આધારકાર્ડ ની નકલ
 - (vi) અનામત કેટેગરી અથવા અન્ય કોઈપણ કેટેગરીનો લાભ લીધેલા ઉમેદવારોએ જે તે કેટેગરીના પ્રમાણપત્રો ની નકલ સાથે લાવવાની રહેશે અન્યથા તેમને અનામત/કેટેગરીનો લાભ મળી શકશે નહીં.
 - (vii) SEBC કેટેગરીના ઉમેદવારોએ 2019-20 માટે માન્ય હોય તેવું નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ રજૂ કરવાનું રહેશે. અન્યથા તેમને SEBC કેટેગરીનો લાભ મળી શકશે નહીં અને લીધેલો પ્રવેશ રદ થશે.
3. ડાઉનલોડ કરેલ એડમિશન ફી રીશિપ્ટ.

નોંધ: ફોર્મ સાથે જોડેલ તમામ પત્રકોના ઓરીજનલ પ્રમાણપત્રો પણ વેરીફિકેશન માટે સાથે રાખવાના રહેશે.